

ત્વરિત જાહેરાત માટે

સીટી ઓફ બ્રેમ્પટન, ડાઉનટાઉનમાં અને પોતાનાના સ્થળાંતર માટેના રોજરના \$100 મિલિયન જેટલા રોકાણને સમર્થન આપે છે

બ્રેમ્પટન, ઓન્ટારિયો (27 જાન્યુઆરી 2022) – ગઈ કાલની બેઠકમાં બ્રેમ્પટન સીટી કાઉન્સિલે રોજર્સ કમ્યુનિકેશન (Rogers Communications)ના ડાઉનટાઉન બ્રેમ્પટનમાં સ્થળાંતર કરવાની ભલામણને મંજૂરી આપી હતી.

પ્રગતિના આ નવા તબક્કાના માધ્યમથી 3,000 કર્મચારીઓ ડાઉનટાઉનમાં 2,00,000 ચોરસ ફૂટની જગ્યામાં સ્થળાંતર કરશે. નવા કેમ્પસમાં ઓફિસ અને છૂટક વેપારની જગ્યાઓનું મિશ્રણ સમાયેલ છે જેમાં તબક્કાવાર વધારાની ઓફિસો માટે જગ્યા કરવામાં આવશે.

આ વ્યૂહાત્મક નવું સ્થાન અને રોકાણ, ગતિશીલ પરિવહનલક્ષી સમુદાયને ઉત્તેજન આપવામાં મદદ કરશે અને કેનેડાના ઈનોવેશન કોરિડોરના કેન્દ્રમાં રોજર્સની નવી કચેરી સ્થિત હશે જેનાથી રોજર્સ તેમજ બ્રેમ્પટન માટે પ્રતિભાઓ સુધીની પહોંચ સુલભ બનશે. ઉપરાંત, રોજર્સ બ્રેમ્પટન કેમ્પસમાંથી સાયબરસિક્યોરિટી એકમનું સ્થળાંતર ઈનોવેશન ડિસ્ટ્રિક્ટમાં થવાથી સાયબરસિક્યોરિટીમાં રાષ્ટ્રીય સ્તરના આગેવાન તરીકે શહેરની સાખ વધશે અને મજબૂત બનશે.

સુવાક્યો

"ડાઉનટાઉન બ્રેમ્પટનમાં રોજર્સના પ્રસ્તાવિત સ્થળાંતરથી મને તો ખૂબ જ રોમાંચની લાગણી થાય છે, જેનાથી હાથ પર લેવાયેલ જબરદસ્ત પરિવર્તન અને તાજેતરમાં સિટી દ્વારા કરાયેલ નિવેશમાં પ્રગતિ થશે. બ્રેમ્પટન આપણા વ્યવસાયો માટે આવકાર આપતું ઘર બને તે સુનિશ્ચિત કરવા અમે પ્રતિબદ્ધ છીએ, અને અમારી કાઉન્સિલ અને કર્મચારીગણ આ નવી પ્રગતિના સમર્થન માટે અમારા તમામ ભાગિદારો સાથે સઘન કાર્ય કરી રહ્યા છે. શહેરના હાર્દમાં રોજર્સની નવી સાઈટથી કેનેડાના ઈનોવેશન કોરિડોરમાં સાયબરસિક્યોરિટીના રાષ્ટ્રીય આગેવાન તરીકેની આપણી સ્થિતિને હજુ મજબૂત બનાવશે અને હું આગામી સોપાનની આતુરતાથી પ્રતિક્ષા કરું છું.

- પેટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

"ડાઉનટાઉન બ્રેમ્પટનને પરિવર્તિત કરવાના પ્રયાસોમાં શહેર હરણફાળ ભરી રહ્યું છે જ્યાં તેમનું વિઝન લોકોને આકર્ષવા, પોસ્ટ-સેકન્ડરી ઉપયોગ અને ઈનોવેશન તેમજ ટેકનોલોજી પર કેન્દ્રિત છે. નવા રોજર્સ કમ્યુનિકેશન ઓફિસના વિકાસના માધ્યમથી તેમજ 3,000 કર્મચારીઓના સ્થળાંતરથી આ કેમ્પસ ડાઉનટાઉનનું દીર્ઘકાલીન પુનરુત્થાન અને આર્થિક સફળતાને બળ આપશે. મે આ રોમાંચક પરિયોજનાનું આયોજન કરતા રહેવા આતુર છીએ જેથી આપણા રહેવાસીઓ, વ્યવસાયો અને સ્થાનિક હિસ્સાધારકો માટે શહેરના હાર્દને ઉન્નત કરી શકાય."

- પૉલ વિસેન્ટ, રીજનલ કાઉન્સિલર, વૉર્ડ 1 અને 5; પ્રમુખ, પબ્લિક વર્ક્સ એન્ડ એન્જિનિયરિંગ, સિટી ઓફ બ્રમ્પટન

"રોજર્સ દ્વારા થયેલ સ્થાનાંતરણ આપણા શહેરના ડાઉનટાઉનમાં ચાલી રહેલા પરિવર્તનકારી કાર્ય અને વ્યૂહાત્મક રોકાણોનું પ્રમાણ છે. આ મિશ્રિત વપરાશના વિકાસને સમર્થન આપીને અમે આપણા રહેવાસીઓ અને વ્યાપારિક સમુદાય માટે વધુ વિસ્તારિત, દીર્ઘકાલીન તકો ઊભી કરી રહ્યા છીએ. મને આ વિકાસને સમર્થન આપતા આંદ થાય છે જેનાથી આપણા શહેર માટે ગતિશીલ અને સ્થિતિસ્થાપક ડાઉનટાઉન ઊભું થશે."

- માર્ટિન મેડિરોસ (Martin Medeiros), રીજનલ કાઉન્સિલર, વૉર્ડ 3 & 4, પ્રમુખ, ઇકોનોમિક ડેવલપમેન્ટ એન્ડ કલ્ચર: સિટી ઓફ બ્રમ્પટન.

"વ્યૂહાત્મક રોકાણો અને આયોજનના માધ્યમથી, અમે અમારા ભાગીદારો અને અમારા વેપારી સમુદાયને સક્રિય આપી રહ્યા છીએ કે અમે સ્માર્ટ, ટકાઉ અને સફળ વિકાસ આગળ ધપાવવા અંગે ગંભીર છીએ. વિશેષ આનંદ તે વાતનો છે કે રોજર્સ પણ આ મુદ્દો સ્વીકારે છે અને આપણા ડાઉનટાઉનમાં થઈ રહેલ પરિવર્તનકારી કાર્યમાં જોડાવા આતુર છે. આ નવી પ્રગતિથી અમે રોજગાર સર્જીશું જેથી આર્થિક પુનરુત્થાન અને વિકાસ થઈ શકે અને બ્રમ્પટનના નિવાસીઓની જીવન ગુણવત્તામાં સુધારો લાવી શકાશે.

- ડેવિડ બારિક, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (David Barrick, Chief Administrative Officer), સિટી ઓફ બ્રમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 7,00,000 કરતા વધુ લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

સિટી ઓફ બ્રમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

multiculturalmedia@brampton.ca